



જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ
બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ -૩૮૮૧૧૦



BACA/SSAC/FMT-03

Farmer Sample Analysis Application Form

નમુનોઓના પૃથક્કરણ માટેના નિયમો

(અ) યુનિવર્સિટી બહારના/જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર હેઠળ આવતા જમીન અને પાણીના નમૂનાઓ:

(૧) ખેતીની જમીન તથા પિયત પાણીના નમુનાઓનુજ ફક્ત નીચે જણાવેલ પરિમાણો માટેજ પૃથક્કરણ કરવામાં આવશે (SSAC/SOP/Soil/01 to 10 and SSAC/SOP/Water/01 to 05). આ સિવાયના નમૂનાઓ અને પરિમાણો માટે પૃથક્કરણ કરવામાં આવશે નહિ.

અ.નં.	જમીન	અ.નં.	પાણી
૧	અમ્લતા આંક (pH _{1:2.5})	૧	અમ્લતા આંક
૨	વિદ્યુત વાહકતા (EC _{1:2.5})	૨	વિદ્યુતવાહકતા
૩	સેન્ટ્રીય કાર્બન	૩	કેલ્શીયમ
૪	લભ્ય ફોસ્ફરસ	૪	મેગનેશીયમ
૫	લભ્ય પોટાશ	૫	સોડીયમ
		૬	કાર્બોનેટ
		૭	બાય કાર્બોનેટ
		૮	ક્લોરાઇડ
		૯	શેષ સોડીયમ કાર્બોનેટ
		૧૦	સોડીયમ અધિશોષણ આંક

- (૨) જમીન/પિયત પાણીનો નમુનો પૃથક્કરણ કરાવનારે વિભાગની પ્રયોગશાળામાં આપવાનો રહેશે. વિભાગમાંથી જમીન/પિયત પાણીનો નમુનો લેવા માટેની પધ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવશે.
- (૩) નમુનો લાવનારે નમુનાની અને અન્ય વિગતની માહિતી નિયત ફોર્મમાં આપવાની રહેશે.
- (૪) જમીન/પિયત પાણીના નમુનાના પૃથક્કરણ માટે યુનિવર્સિટીના વખતો વખતના નિયત કરેલ દરો ચુકવવાનો રહેશે અને તેનું ચુકવણું થયા બાદ જ પૃથક્કરણ કરવામાં આવશે.
- (૫) નમુનાઓ અત્રેની કચેરીમાં જમા કરાવ્યા બાદ ૩૦ દિવસમાં પૃથક્કરણનો રીપોર્ટ મળી શકશે. પૃથક્કરણનો રીપોર્ટ ૩બ૩માં અથવા પત્ર અથવા ઈ-મેઈલ દ્વારા મળી શકશે.
- (૬) કુદરતી આફતો, નમુનાઓનું ભારણ, મશીનમાં તાંત્રિક ખામી કે અન્ય કે જેમાં પૃથક્કરણનો રીપોર્ટ ૩૦ દિવસની અંદર આપી શકાય તેમ ન હોય તેવા સંજોગોમાં તેની જાણ ફોન/પત્ર/ ઈ-મેઈલદ્વારા કરવામાં આવશે.
- (૭) વિભાગમાં પૃથક્કરણકર્તા/સાધનોની કાર્યરત્તા/રસાયણો અથવા અન્ય કોઈ વિગત કે જે પૃથક્કરણને અસરકર્તા હોઈ તેની ઉપલબ્ધી ન હોયતો નમુનો સ્વીકારવામાં આવશે નહીં.
- (૮) પૃથક્કરણ નો રીપોર્ટ અત્રેથી આપ્યા/રવાના કર્યાબાદ ૧૫ દિવસ સુધી નમુનાઓની અત્રે જાળવણી કરવામાં આવશે. આ સમયગાળો વિત્યાબાદ તેનો નિકાલ કરવામાં આવશે.
- (૯) કોઈ પ્રમાણપત્ર આપવામાં આવશે નહિ પરંતુ પૃથક્કરણનો રીપોર્ટ આપવામાં આવશે અને પૃથક્કરણ રીપોર્ટના આધારે વિભાગની નિપુણતા મુજબ માર્ગદર્શન આપવામાં આવશે. જે નિપુણતા આ વિભાગમાં ઉપલબ્ધ ન હોય તેનું માર્ગદર્શન અન્ય વિષય નિષ્ણાંત પાસેથી લેવાનું રહેશે.